

November 11, 2025

To,
Manager - Listing Compliance
National Stock Exchange of India Limited
'Exchange Plaza'. C-1, Block G,
Bandra Kurla Complex, Bandra (E),
Mumbai - 400 051

Symbol: SOLEX

Dear Sir,

Sub: - Newspaper Publication of Unaudited Standalone & Consolidated Financial Results for the Quarter and Half year Ended September 30, 2025

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 please find attached herewith copies of newspaper advertisements dated November 11, 2025 published in The Economic Times (English)-All Gujarat Edition, The Economic Times (English)-Mumbai Edition, Mumbai Mirror, Divya Bhaskar (Gujarati), Gujarat Samachar (Gujarati), Sandesh (Gujarati), wherein the Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the Quarter and Half Year ended September 30, 2025 have been published.

The above information is also available on the website of the Company www.solex.in.

Thanking you,

Yours faithfully,
For, Solex Energy Limited



Azmin Chiniwala
Company Secretary & Compliance Officer

Encl: As Above

BUILDING ARTIFICIAL INTELLIGENCE PROJECTS

Why Debt Funding Is Raising Risks of A Boom

Debt used to fund data centres could exceed \$1 trillion by 2028, or more than a third of all dollars spent on these facilities

For years, the tech industry's giants, which make tens of billions of dollars in annual profits, usually built new data centres with their own money. Just last year, Google expanded an already massive computing facility in Oklahoma, while Amazon went to work on a new data center in Indiana that will eventually use enough electricity to power more than a million homes.

But a new set of free spenders is emerging in the gallop toward bigger and bigger artificial intelligence projects. Smaller outfits — far from household names — are nearly as wealthy but eager to get in on the AI boom — have started to build their own giant data centres. And they are borrowing tens of billions of dollars to do it.

In September, Meta agreed to buy \$14.3 billion in computing power from CoreWeave, a New Jersey company that went public this year. CoreWeave has told financial analysts that for every \$5 billion in computing power it plans to sell to customers over the next four years through new data centres, it must borrow \$2.85 billion.


The same month, Microsoft made a similar deal with Nebius, a startup based in Amsterdam, for \$19.4 billion. To help build its data centres, Nebius recently sold \$3.16 billion in what are called convertible notes, which can be converted into company shares years down the road but begin as debt.

Now, there are growing concerns that these smaller companies are shouldering risks they might not be able to handle, entwining themselves in relationships that financial analysts say are worryingly opaque. So are a handful of much larger companies that are working with OpenAI, the San Francisco company that launched the AI boom with its ChatGPT chatbot three years ago.

The debt used to fund data centres could exceed \$1 trillion by 2028, or more than a third of all dollars spent on these facilities, according to analysts at Morgan Stanley. If AI technologies do not pull in as much revenue as expected over the next several years, the debt-laden companies could be left holding the bag for the rest of the industry.

"People are lending an awful lot of money to companies based on speculative returns," said Gil Luria, head of technology research at the technology analyst DA Davidson.

The shift to debt financing is reminiscent of the dot-com boom in the late 1990s, when many companies racked up debt as they raced to lay the fiber-optic cables that would become today's high-speed internet. When the bubble burst, companies such as WorldCom, Global Crossing and Lucent went bankrupt or had to



sell themselves to larger rivals. Contributing to this mounting pile of debt are projects led by OpenAI. Even though the company is pulling in billions of dollars in annual revenue, its chief executive, Sam Altman, has said it will not be profitable until 2028. But OpenAI and several partners, including the software giant Oracle and the Japanese conglomerate SoftBank, plan to spend more than \$400 billion building data centres in Texas, New Mexico, Ohio and Wisconsin. It is unclear how much debt the company and its partners are taking on to pay for all of that.

Days after OpenAI announced its new data centres, Oracle said it would take on an additional \$18 billion in debt. Analysts at KeyBank Capital Markets estimate that Oracle will have to borrow \$25 billion a year over the next four years to build these facilities. And in some cases, Oracle

BORROWING MONEY

As companies borrow money to build data centres, their collateral is sometimes the computer chips they will install in these giant facilities

is paying for only part of the data centre. At OpenAI's first data center in Abilene, Texas, Oracle is paying for the computer hardware inside, while a company called Crusoe is responsible for erecting the building, the heating equipment and other infrastructure.

For its part of the project, Crusoe borrowed \$15 billion through a partnership involving Blue Owl Capital, a private credit lender that is helping to fund several data centres across the country and will own the one in Abilene.

"People have arranged a similar deal with Blue Owl to borrow \$27 billion for a data center in Louisiana. Softbank and OpenAI intend to pay for new facilities in Ohio and Texas in part by borrowing money, according to two sources familiar with the arrangement who spoke on the condition of anonymity.

In recent weeks, OpenAI made a series of unorthodox deals to raise additional money. First, it sold a stake in the company to the chipmaker Nvidia for \$100 billion. Then AMD,

an Nvidia rival, agreed to essentially give OpenAI tens of millions of AMD shares, which could be worth tens of billions of dollars.

OpenAI has also agreed to buy computer chips from these companies as it builds its data centres. If OpenAI does not need those chips, Nvidia and AMD can pull out of the deals, but OpenAI and others could still be on the hook for the debt they have taken on.

(The New York Times sued OpenAI and Microsoft in 2023, claiming copyright infringement of news content related to AI systems. The two companies have denied those claims.)

"The risks is that companies will buy a bunch of computer chips for AI and they won't have the revenues to pay for them," said Andrew Odlyzko, a mathematician and historian who specializes in the technological mania of the recent and distant past. "Bubbles take a long time to build. But they burst very quickly."

As companies borrow money to build data centres, their collateral is sometimes the computer chips they will install in these giant facilities; if the companies default on their loans, their lenders own the chips. But computer chips, like cars, are worth less over time.

The risks could extend beyond the tech industry, financial experts say. The data center debt is held by a wide array of financial institutions, including traditional banks, private credit lenders like Blue Owl and Arco Management, and the many companies that are funding new computing facilities.

"Who is holding all this debt? It is not like it is just being held by big banks. It is all over the place," said Paul Kedrosky, a research fellow at Massachusetts Institute of Technology's Institute for the Digital Economy, who has closely tracked spending on new data centres for AI. "A lot of little pieces of debt are spread throughout the economy."

The opacity of many of these deals has made it hard for financial analysts to figure out, said Jeremy Kress, an associate professor of business law at the University of Michigan who specializes in systemic risk in the economy and financial stability. If the loans are highly leveraged — meaning that the lenders have taken on their own debt to make the loans — the risks go up.

"Leverage in the system is what drives risk," Kress said. "And it is hard to know how much leverage is in the system." NYT

EEPC Seeks Govt Support to Tide over US Tariffs

New Delhi: The Engineering Export Promotion Council (EEPC) has sought a special support package for exporters to tide them over the steep US tariffs, as other exporting countries have an average of 30% head start compared to India.

"The 50% tariff imposition by the US increases tariff differential with our competitors... A special support package that can absorb 15% of this differential would help us to secure our position," said Panjaj Chaudhary, chairman of Engineering Export Promotion Council.

—Our Bureau

SOLEX ENERGY

Our Power Keeps Shining Brighter, Just Like the Sun.

Industry 4.0-Aligned Facilities
4 GW Manufacturing Capacity

Globally Recognized Certifications
3 M+ Modules Shipped



	HI FY2026	HI FY2025	Growth in %
TOTAL REVENUE (Lakhs)	41,568	27,417	52%
EBITDA (Lakhs)	6,091	2,637	131%
PAT (Lakhs)	3,049	1,308	133%

Our High-Efficiency Product Range:

Tapi

Including Tapi R, Tapi Trans Dual, Tapi Series, & Tapi Black; delivers up to 625W of solar power for next-gen solar systems.

1800 572 8787
info@solex.in
solex.in



Statement of Unaudited Consolidated Financial Results For HI FY 2026
The full format of the Financial Results are available on the Stock Exchange websites (www.nseindia.com) and on Company's Website (www.solex.in).

Corporate & Registered Office:

Solex Energy Limited, 8th Floor, Rio Empire, Opp. RTO, Pal, Surat - 395009, Gujarat

Fed's Alberto Musalem Sees US Economic Rebound in First Qtr

Bloomberg

Federal Reserve Bank of St. Louis President Alberto Musalem said he expects the US economy to bounce back strongly early next year, underscoring the need for policy to approach additional interest rate cuts with caution.

"We're going to get, I think, a substantial rebound in the first quarter," Musalem said Monday, citing an expected bump when the government shutdown ends, fiscal support, the impact of rate cuts already made and deregulation.

Speaking with Bloomberg reporters and editors, Musalem reiterated his view that the economy is closer to the level where it would no longer put downward pressure on inflation.

"It is very important that we tread with caution, because I believe there's limited room for reporters and editors. Musalem reiterated his view that the economy is closer to the level where it would no longer put downward pressure on inflation.



Further reductions without monetary policy becoming overly accommodative," he said. After lowering interest rates twice this year, Fed officials are divided over how much more to cut borrowing costs. Fed chair Jerome Powell said last month that a rate cut in December was not a foregone conclusion. And several officials speaking since the central bank's October gathering have pushed for a pause in December, emphasizing the need to tame above-target inflation. Musalem said he is seeing increasing signs of strain among low and middle-income households who are struggling to cover rising expenses.

main limited to sugar production. Factories must also focus on ethanol, biofuel and aviation fuel," he added. The Union Minister for Road Transport and Highways was speaking at an event to mark the start of the 42nd crushing season of Shri Nilkantheshwar Shetkari Sahakari Sakhar Karkhana in Lini in Aurangabad, Maharashtra.

Local MLA Abhimanyu Pawar, who played a role in boosting the prospects of the factory, said farmers will receive ₹3.01 per tonne of sugarcane this season.


Latur: Union minister Nitin Gadkari on Monday urged sugarcane cultivators to increase yield for higher income and said they must use modern technology, including artificial intelligence, for this purpose.

For the sugar industry to remain profitable, production must exceed 60 tonnes per acre, he said. Sugarcane cultivators must increase yield through modern technology, including artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

"The sector should not rely on subsidies but rather on productivity and efficiency," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.



He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

Investigation Ongoing

From Page 1

A high alert has been sounded in New Delhi and many other states.

Teams from Delhi Police's Crime Branch and Special Branch reached the spot, at the Subhash Marg traffic signal, within 10 minutes of receiving information of the explosion. Delhi Police Commissioner Satish Golecha and Special Branch in-charge were also at the spot.

The NSG and National Investigation Agency (NIA), along with FSL, have now begun an investigation. Orders have been given to examine all nearby CCTV cameras.

The blast came a day after Jammu and Kashmir Police seized 350 kg of explosives, along with an AK-47 rifle from Faridabad, in NCR. This followed revelations made during questioning by a doctor from Jammu and Kashmir, Adil Ahmad Rather, who is suspected of links to banned terror outfit Jaish-e-Mohammed.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

Gadkari Asks Sugarcane Cultivators to Increase Yield via Use of Tech, AI

PTI

Latur: Union minister Nitin Gadkari on Monday urged sugarcane cultivators to increase yield for higher income and said they must use modern technology, including artificial intelligence, for this purpose.

For the sugar industry to remain profitable, production must exceed 60 tonnes per acre, he said. Sugarcane cultivators must increase yield through modern technology, including artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

"The sector should not rely on subsidies but rather on productivity and efficiency," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

He also urged farmers to adopt modern technology and artificial intelligence (AI) in the agricultural sector, he became essential if farmers are to get their due," he said.

Integrated Vision Inclusive Infrastructure Innovative Financing

FINANCING ASSETS FOR VIKSIT BHARAT NBFC - IFC

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS (STANDALONE & CONSOLIDATED) FOR THE QUARTER/HALF YEAR ENDED 30th SEPTEMBER, 2025 (₹ in crore)

PARTICULARS	STANDALONE			CONSOLIDATED		
	QUARTER ENDED 30/09/25 (Unaudited)	QUARTER ENDED 30/09/24 (Unaudited)	QUARTER ENDED 30/09/25 (Audited)	QUARTER ENDED 30/09/25 (Unaudited)	QUARTER ENDED 30/09/24 (Unaudited)	QUARTER ENDED 30/09/25 (Audited)
Total Income from Operations (Net)	3,219.03	2,517.72	6,156.34	4,706.07	10,311.29	3,219.03
Net Profit for the Period (before tax & exceptional items)	954.71	1,000.04	1,811.94	1,684.74	3,636.66	954.71
Net Profit for the Period (after tax)	954.71	1,000.04	1,811.94	1,684.74	3,636.66	954.71
Net Profit for the Period (after tax) (after exceptional items)	709.83	688.62	1,340.06	1,246.37	2,709.14	709.83
Total Comprehensive Income for the Period (after tax) and other comprehensive income (after tax)	823.09	537.03	509.23	1,075.72	2,544.34	823.09
Paid up Equity Share Capital (₹ - ₹ 10/- each)	2,001.90	2,001.90	2,001.90	2,001.90	2,001.90	2,001.90
Other Equity (excluding Revaluation Reserve)	N.A.	N.A.	N.A.	15,967.89	N.A.	N.A.
Securities Premium Account	N.A.	N.A.	N.A.	1.26	N.A.	N.A.
Net Worth	N.A.	N.A.	N.A.	17,969.79	N.A.	N.A.
Paid up Debt Capital/ Outstanding Debt*	-	-	-	1,07,280.61	-	-
Debt Equity Ratio	N.A.	N.A.	N.A.	5.72	N.A.	N.A.
Earnings Per Share (₹ - ₹ 10/- each) (EPS for quarter/ half year are not annualised)	(i) Basic	3.55	3.44	6.69	6.23	13.53
(ii) Diluted	3.55	3.44	6.69	6.23	13.53	3.55
Debt Redemption Reserve** (as at year end)	N.A.	N.A.	N.A.	2,965.69	N.A.	N.A.

* Outstanding Debt excluding Ind As Adjustments ** Debt Redemption Reserve as on 31st March 2025 respectively.

NOTES:
1. The above financial results of the company have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors in their meeting held on 10th November, 2025. These financial results have also been reviewed by M/S S.A.R.C.A. Associates, Chartered Accountants, Statutory Auditors of the Company.
2. The Board of the company approved the 2nd Interim Dividend for FY 2025-26 @ ₹ 1 per share of ₹ 10 each. The record date for determining the eligibility of shareholders for receipt of 2nd interim dividend has been fixed as 19th November, 2025. The dividend will be paid within 30 days of the declaration.
3. The above is an extract of the detailed format of Quarterly/Half Year Financial Results filed with the Stock Exchanges under Regulation 33 and 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results are available on the websites of BSE Limited (URL: www.bseindia.com/corporates), National Stock Exchange of India Limited (URL: www.nseindia.com/corporates) and the same is also available on the company's website (URL: www.hudco.org.in).
4. The above is an extract of the detailed format of Quarterly/Half Year Financial Results filed with the Stock Exchanges under Regulation 33 and 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results are available on the websites of BSE Limited (URL: www.bseindia.com/corporates), National Stock Exchange of India Limited (URL: www.nseindia.com/corporates) and the same is also available on the company's website (URL: www.hudco.org.in).
5. There is no change in the accounting policy during the Quarter/Half Year; hence there is no impact on Net Profit/Loss, Total Comprehensive Income or any other relevant Financial Item(s) due to change(s) in accounting policies.

Place: New Delhi
Date: 10.11.2025

PRODUCTS & SERVICES FINANCING CONSULTANCY CAPACITY BUILDING

For and on behalf of the Board of Directors
Sanjay Kulkarni
Chairman & Managing Director

HOUSING AND URBAN DEVELOPMENT CORPORATION LTD. (HUDCO)
(A Govt. of India Enterprise)
Registered Office: Hudco Bhawan, Conno 7A, India Habitat Centre, Lodhi Road, New Delhi - 110 003
CIN: L74899DL1970G01005276 | GSTIN: 07AAACH0632A1Z7 | www.hudco.org.in | Follow us on: [Social Media Icons]

Chinese firm under EOW lens for selling junk machinery to city co

Zoomlion sold 7-yr-old piling rigs as 'new' to Infracon Resources; chargesheet names top company officials

I Saurabh Vaktania
saurabh.vaktania@timesofindia.com

Blowing the lid off a cross-border fraud with international ramifications, Mumbai's Economic Offences Wing (EOW) has chargesheeted top officials of the Indian arm of a Chinese heavy machinery behemoth.

The chargesheet, filed in a Mumbai court, is against the Indian subsidiary of the Chinese giant, Zoomlion Heavy Industries Science & Technology Co Ltd, for allegedly duping a local Mumbai-based firm, Infracon Resources (an MSME), by supplying 10 dilapidated and obsolete piling machines disguised as brand-new equipment. The court has issued summons to key company officials, including two Chinese nationals who remain absconding. The court will hear the matter on December 6.

The anatomy of the 'junk' deal

The sensational allegations stem from a 2019 deal in which Mumbai-based Infracon Resources was allegedly induced into purchasing 10 specialised piling rigs. What they received, according to the official complaint, was anything but new. The machines were "refurbished, old, and junk," equipped with obsolete technology and engines that were already seven years old.

Despite EOW confirming strong evidence against the Chinese officials, both are yet to be arrested as they are based out of China. The EOW is now securing necessary multi-level permissions for their arrest

When the faulty machines failed to perform as promised, Infracon, represented by Assistant Manager Yogendra Dipak Deshmukh, attempted multiple avenues for resolution, including mediation and arbitration, only to find no satisfactory answer. With their operations crippled and investment lost, the company finally filed a First Information Report (FIR) with the Mumbai Police in 2022. The case, initially registered at Amboli Police Station, was later transferred to EOW for an in-depth investigation.

EOW's chargesheet

Following a thorough investigation, including a detailed review of documents and collection of witness statements, the EOW filed its chargesheet in March 2025. The formal document charges the accused under stringent sections of the Indian Penal Code (IPC): Section 420 (Cheating and dishonestly inducing deliv-

ery of property) and Section 34 (Acts done by several persons in furtherance of common intention). The EOW asserts that it possesses "strong written and oral evidence" against the charged officials. The Additional Chief Judicial Magistrate at Mumbai's 47th Court has taken cognisance of the chargesheet and issued official summons to the prime suspects:

- Roy Chen (Chinese National): Managing Director of Zoomlion India Pvt. Ltd. operations in Panvel, Raigad.
- Huwan Qun (Chinese National): Age 57, Additional Director of Zoomlion India Pvt. Ltd. since March 2013.
- R Senthil Kumar (Indian National): Former Market Head of the company.

The chargesheet specifically states that all three individuals were responsible for inducing the complainant to purchase the ten faulty piling machines.

Despite the EOW confirming "strong written and oral evidence" against the senior Chinese officials, Managing Director Roy Chen and Additional Director Huwan Qun could not be arrested as they are based out of China. The EOW dossier explains that both individuals are Chinese nationals, and securing the necessary multi-level permissions for their arrest or extradition would potentially cause undue delays to the entire criminal investigation.

These senior Chinese officials have been

non-cooperative, reportedly failing to respond to notices issued by the EOW. Due to their absconding status and lack of response, the EOW has formally requested the court to allow further investigation under Section 173(8) of the Criminal Procedure Code (CrPC).



सूर्यशीर्ष, विश्वासशी प्रगति.

Industry 4.0
Aligned Facilities
4 GW
Manufacturing Capacity
3M+
Modules Shipped

	HI FY2026 (*Rs. in Lakhs)	HI FY2025	Scan To Download Financial Results
TOTAL REVENUE	41,568	27,417	
EBITDA	6,091	2,637	
PAT	3,049	1,308	

The full format of the Financial Results are available on the Stock Exchange websites (www.nseindia.com | Symbol - SOLEX) and on Company's Website (www.solex.in).

1800 572 8787
info@solex.in
solex.in

Corporate & Registered Office: Solex Energy Limited, 8th Floor, Rio Empire, Opp. RTO, Pal, Surat - 395009, Gujarat.

Lawyer's murder case: Bombay HC upholds life for security guard

13 years after Wadala murder, court rejects convict Sajjad Mugal's appeal and the State's plea for a death sentence

I A Correspondent
mirrorfeedback@timesofindia.com

Thirteen years after the brutal killing of corporate lawyer Pallavi Purkayastha shocked Mumbai, the Bombay High Court has upheld the conviction and life sentence of the building's watchman, Sajjad Ahmed Abdul Aziz Mugal alias Pathan.

A division bench of Justices Ajay Gadkari and Dr Neela Gokhale on Monday dismissed Sajjad's appeal challenging his conviction and confirmed the sessions court's 2014 judgment that found him guilty of murder. The bench also turned down the State's plea seeking enhancement of his sentence from life imprisonment to death. The detailed judgment is yet to be made available.

The ruling, legal experts say, underscores that the judiciary will not show leniency in crimes involving sexual violence and betrayal of trust by those tasked with ensuring safety.

The incident dates back to August 9, 2012, when Pallavi, a 25-year-old lawyer working with a film production house, was found dead in her apartment at Himalayan Heights in Wadala.

Investigators revealed that Sajjad, employed as a security guard in the building, had deliberately disrupted the electricity supply to Pallavi's flat. When she called an electrician, he accompanied the man, quietly took



Sajjad Ahmed assaulted Pallavi and stabbed her multiple times before fleeing

a duplicate key, and later returned to her home.

Once inside, Sajjad attempted to sexually assault Pallavi. When she resisted, he attacked her with a knife, stabbing her multiple times before fleeing. Police traced and arrested him within days, and in July 2014, a Mumbai sessions court convicted him of murder, sentencing him to life imprisonment.

However, in 2016, Sajjad managed to secure parole on the pretext of visiting his ailing mother in Kashmir. Instead, he disappeared, changed his identity, and took up another watchman's job in Andheri. He was tracked down and arrested about a year later, after a sustained manhunt.



Winds that power India's trust

When India demanded more, Suzlon stepped in with end-to-end solutions, so India Inc. could leverage green power without the complexities of EPC, development, and generation. We valued relationships above all, as we helped customers navigate India's complex regulatory, environmental, and stakeholder landscape. As we powered the nation, we earned what matters most - India's trust.

India's most trusted winds



Scan here to view our 30-year journey

સાડીઓનો જથ્થો સગેવગે કર્યો, 2 કારખાનેદાર સહિત 3 સામે ગુનો એકાઉન્ટન્ટ બોગસ એન્ટ્રીથી 3 વર્ષમાં 3.55 કરોડ ચાઈ કર્યા, 50 લાખનું મકાન બનાવ્યું

કામ રિપોર્ટ સુરત

રિંગરોડની શ્રીશ્યામ સિલ્ક મિલના એકાઉન્ટન્ટ બોગસ એન્ટ્રીથી તેમજ બે કારખાનેદાર સામે મળી 3.55 કરોડની ઉધાપત કરી હતી. રૂબાલ રહેતા મનીષ અગ્રવાલની રિંગરોડ ખાતે જે.વી.ટેક્સટાઈલ માર્કેટમાં સાડી તથા દુપટ્ટાનો વેપાર કરે છે. તેમને ત્યાં 15 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે સુનિત ઉર્ફે સમ્રાટ શિવજી ગુપ્તા (સાઈ મોહન-5, વડોદ, બેન્ગાળ) નોકરી કરતો હતો.

સાડી પર જોબર્ક કરાવવા અને પરત લેવા તેમજ પેમન્ટની જવાબદારી પણ તેની પાસે હતી. દાખલ બગડતા સુનિતે કારખાનેદાર દિલીપ મોચીરામ (જગન્નાથનગર પોલીસ) અને અક્ષર હેન્ડ એન્ડ્રોઈડી તથા સિદ્ધાંત કોએશનના અશ્વિન કલ્યાણસાવલીયા (સરવાણા) સાથે

શૈલેષ પાસેથી 35 હજારનો મુદ્દામાલ જપ જુગાર રમવા માટે ડ્રગ્સ વેચતો યુવક 2 ગ્રામ MD સાથે ઝડપાયો કીમના કાદીર પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો

કામ રિપોર્ટ સુરત

કાપોદરા પોલીસે નાના વરાછા વાવી ગુહ નજીક આવેલા બસ સ્ટેશન પાસેથી 3.8.847 કિમના 2.949 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો. યુવક જુગારની લત ના કારણે છુટકમાં ડ્રગ્સ વેચાણ માટે કિમના એક યુવક પાસેથી લાવ્યો હતો.

બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કાપોદરા પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ નાના વરાછા વાવીગુહ પાસેના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે એમડી ડ્રગ્સ વેચવા માટે આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાઈક પર સવાર થઈને ત્યાં આવેલા શૈલેષ વાલજીભાઈ સાકરીયા (રહે.)

ઉધરાણી માટે ઓકિશા જતાં ભાંડો ફૂટ્યો

વેપારી મનીષ ઓકિશાના ભવનશરમાં ઉધરાણી માટે ગયા ત્યારે ત્યાં તેમની સાડીનો સેસલા ભાવે વેચાતી હતી. તપાસ કરતા આ સાડીનો વેપારીને સુરતથી સેસલા ભાવે મોકલી હતી. મનીષકુમારે નાના ભાઈ હેમનને ફોન કરતા તેણે તપાસ કરી ત્યારે ઉધાપત કર્યાનો ભાંડો ફૂટ્યો હતો.

સુરત બહાર સાડીઓ સગેવગે કરાતી હતી

આરોપી સુનિત કારખાનેદારને 1500 સાડી મોકલતો હતો જ્યારે પેઢીમાં 1000 સાડી જ બતાવતો હતો. બાકીની સાડીઓ બજાર ભાવ કરતા 50 ટકા ભાવે વેચી દેતો હતો. જ્યારે પકડાઈ નહીં તે માટે સુરત બહાર જ આ માલ વેચવામાં આવતો હતો.

મળી ઉધાપત કરી હતી. એપ્રિલ 2023થી માર્ચ 2025 દરમિયાન સુનિતે આ કારખાનેદારને જોબર્ક માટે અપેલી સાડીકરતા વધુ સાડી બતાવીને બોગસ એન્ટ્રીમાં 3.28.33 લાખ ઉધાડી લીધા હતા. જોબર્ક માટે અપેલી સાડી ઓછી બતાવીને બોગસ ભાવે વેચી

નાઈક કિવાઈડર સાથે ભટકાતા વિદ્યાર્થીનું મોત

સુરત : અગ્રજી રહેતા સંજય શેઠનો 18 વર્ષીય પુત્ર રાહીલ સી.કે. પીકાવાલા કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરતો હતો. સોમવાર રાહીલ કોલેજ જતો હતો ત્યારે બાઈક રીપેરીંગ સાથે ભટકાતા ઈજાગ્રસ્ત થયો હતો. બાનગી હોસ્પિટલ લઈ જવાતા મૃત જોહેર કરાયો હતો.

વ્યાજે આપેલા 20 લાખના બદલે વ્યાજખોરે મકાન પચાવી વિધવા અને પુત્રને કાઢી મૂક્યા

કામ રિપોર્ટ સુરત

અમરોલી સાઈ લાઈટ રેસીડેન્સીમાં રહેતી 37 વર્ષની વિધવાને પૈસાની જરૂર પડતા વ્યાજખોરે રાણા ભગા ભમ્બર (સપના સોસાયટી, વરાછા) પાસેથી 20 લાખ 2 ટકાના વ્યાજે લીધા હતા. જેના બદલામાં રાણાએ

તેમનું પુણામાં આવેલું મકાન લખાવી લીધું હતું. માર્ચ 2025 સુધી 6ર મહિને વિધવાએ નિયમિત વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ પૈસાની સગવડ નહીં થતા વ્યાજ ચૂકવી શક્યા ન હતા. જેથી રામાએ ઉધરાણી શરૂ કરી ધમકી આપીને માતા-પુત્રને મકાનમાંથી કાઢી મૂકી

કબજે કરી લીધો હતો. એટલું જ નહીં વધુ વ્યાજની માંગણી કરી વિધવા પરમાં એકલી હતી ત્યારે રાણા પર પહોંચી જઈ અડધલા કરીને બિબેલ્સ માંગણી કરી હતી. વિધવાની ફરિયાદ પર પૂણા પોલીસે રાણા આહિર સામે ગુનો દાખલ કર્યો હતો.

SALE OF NATURAL GAS AND CRUDE OIL FROM JAYA FIELD

NOTICE INVITING OFFER

Cairn Oil & Gas, Vedanta Limited ("Vedanta") invites offer from interested entities ("Bidders") for the purchase of natural gas or crude oil from Jaya Field located in Jamnabur, Dist. Bharuch, Gujarat.

Vedanta Limited has appointed M/S Junction Services Limited ("e-Bidding agency"), as an independent agency, empaneled by Directorate General of Hydrocarbons (DGH), to conduct e-Bidding process for sale of natural gas through an online web based electronic bidding platform ("e-Bidding Platform").

Block: CB-OHNP-2017/02
Natural Gas
RFP: RFP/Jaya/2026/1
Quality: -11000 KCal/SCM
Quantity: Refer RFP

Crude Oil
RFP: RFP/OALP/CB/2025/02
Quality: API: 63.2 deg; Sulphur: 0.0018 wt%
Quantity: 2,800 KL/month

The prospective Bidders are required to download the RFP(s) available at <https://eps.buyjunction.in/gasbidding> and follow instructions therein to participate in the bidding process. For any queries related to RFP(s), please contact e-Bidding agency at caimgasbidding@junction.in (for natural gas) and caimolbidding@junction.in (for crude oil).

SUSTAINABLE & RESPONSIBLE DEVELOPMENT

ENHANCING PRODUCTION FOR A SELF-RELIANT INDIA

દેક્સરી કોન્ટ્રાક્ટ આપવાનો છે.

દિવ્ય ભાસ્કરને તેના અખબારના એજન્ટોને પેપર પહોંચતા કરવા માટે સુરત શહેર અને બહારગામના રૂટ માટે (ઇકો/સુપર કેરી/પીકઅપ) નો કોન્ટ્રાક્ટ આપવાનો છે.

સમય: સવારે 11.00 થી સાંજે 5.00 દરમિયાન

બીજો માળ, VIP લાગ્રા, રથાબા બાબા મંદિરની બાજુમાં, VIP રોડ, વેસુ.

Mo. 80004 97020, 90999 46019

સૂર્યથી ઊર્જા, વિશ્વાસથી પ્રગતિ.

Industry 4.0 | **4 GW** | **3 M+**
 Aligned Facilities | Manufacturing Capacity | Modules Shipped

Statement of Unaudited Consolidated Financial Results For H1 FY 2026 (*Rs. In Lakhs)

	H1 FY2026	H1 FY2025
TOTAL REVENUE	41,568	27,417
EBITDA	6,091	2,637
PAT	3,049	1,308

The full format of the Financial Results are available on the Stock Exchange websites (www.nseindia.com | Symbol - SOLEX) and on Company's Website (www.solex.in).

Our High-Efficiency Including Tapi R, Tapi Trans Dual, Tapi Series, & Tapi Black; delivers up to 625W of solar power for next-gen solar systems.

Tapi

☎ 1800 572 8787 ✉ info@solex.in 🌐 solex.in
 Corporate & Registered Office: Solex Energy Limited, 8th Floor, Rio Empire, Opp. RTO, Pal, Surat - 395009, Gujarat

ANAND PAANDIT MOTION PICTURES & JAINOCK FILMS PRESENT

દિવસે દિવસે વધુને વધુ લોકપ્રિયતા હાંસલ કરતી ગુજરાતી ફિલ્મ...

ફક્ત આજે ₹99*

ચણિયા રોની

કિર્મી જર બોલકાસ પાલ વિહરી

નિર્મલ આનંદ પિક્ચર વિશલ શાહ

SCAN THIS QR CODE FOR THE THEATRE LISTING AND SHOW TIMING

SCAN THIS QR CODE TO BOOK YOUR TICKETS NOW

SOUL SUTRA & D.D. BROTHERS MOVIES PRESENT

IMDb 9.5/10

DIVINE BLOCKBUSTER

9.0/10

ONLY FOR TODAY SPECIAL OFFER

TICKETS AT JUST ₹92 / ₹149

KARAN JOSHI REEVA RACHH SHRUHAD GOSWAMI

સ્વામલા રોજના, આરોગ્યનો ખજાનો!

ક્લાસિક

- સ્વાસ્થ્ય જાળવી રાખનાર
- રોગપ્રતિકારક શક્તિ વધારનાર
- શરીર ઘટકોની આપૂર્તિ કરે
- શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારે
- નબળાઈ દૂર કરે

સ્વામલા

નો ઓફેડ શુગર

શ્રી ધૃતપાપેશ્વર લિમિટેડ | હાસબેલ, પ્રમાણિત, સુશ્રુતિ આયુર્વેદિક દવાઓ | Health & Trade Enquiries: 1800 22 9874

Get the fastest and most accurate news of the

BIHAR ELECTIONS 2025

on the Bhaskar English App

Bhaskar Reporters' Poll

Judging who has the edge over whom

Bhaskar English App

Scan the QR and download the App now!

અમેરિકામાં શટડાઉન પૂરું થવાના સંકેતે વૈશ્વિક સોનું ઊંચકાયું ઘરઆંગણે સોનામાં રૂપિયા ૨૦૦૦ જ્યારે ચાંદીમાં રૂપિયા ૩૦૦૦થી વધુનો ઉછાળો

મુંબઈ, સોમવાર: અમેરિકામાં ૪૦ દિવસથી ચાલી રહેલા શટડાઉનનો અંત આવવાના મંથનમાં સંકેતે પરિણામે વૈશ્વિક સોનાચાંદી બજારમાં મોટો ઉછાળો આવ્યો હતો. અમેરિકાના આર્થિક ડેટા નમુના આવતા વ્યાજ દરમાં વધુ કપાતની શક્યતા પણ વધી ગઈ છે તેને કારણે પણ કિંમતી યાતુના ભાવને ઊંચકી મળ્યું છે. રોલરમાં નમુનાને કારણે

પણ ૬૦ હાંસોનું ગોલમાં આંશિક રહ્યું હતું. વિશ્વ બજારમાં સોનામાં એક જ દિવસમાં ૮૦ રૂબરોનો ઉછાળો આવ્યો હતો અને ભાવ ફરી ૪૧૦૦ રૂબરોની નજીક પહોંચી ગયા હતા. ચાંદીએ ૫૦ રૂબરોની સપાટી પાર કરી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનામાં રૂપિયા ૨૦૦૦થી વધુ જ્યારે ચાંદીમાં રૂપિયા

પ્લેટિનમ તથા પેલેડિયમ ઊંચકાયા: વૈશ્વિક કુડના ભાવમાં સ્થિરતા

૩૦૦૦થી વધુનો ઉછાળો આવ્યો હતો. કુડ તરફના સ્થિરતા થવા મળી હતી, જ્યારે રોલર સામે રૂપિયા સહજ નરમ પડ્યો હતો. શટડાઉનના કારણે અમેરિકામાં નવેમ્બરના પ્રારંભે કમ્પાઉન્ડ સિસ્ટમને ઘટીને સાડા ઘણ વર્ષની નીચી સપાટીએ ઉતરી આવ્યું હતું. જેની બજાર પર અસર જોવા મળી હતી. મુંબઈ ખેતી બજારમાં ૯૮.૮૦ સોનાના પ્રાથમિક દર પ્રાપ્ત થયા હતા. પ્લેટિનમના પ્રાથમિક દર ૨૩૦૦ રૂપિયા ૧,૨૧,૨૪૪ મુકાતા હતા. પેલેડિયમના પ્રાથમિક દર ૨૩૦૦ રૂપિયા ૧,૨૧,૨૪૪ મુકાતા હતા. ૯૮.૫૦ સોનાના દર પ્રાપ્ત થયા હતા. પ્લેટિનમના પ્રાથમિક દર ૨૩૦૦ રૂપિયા ૧,૨૧,૨૪૪ મુકાતા હતા. પેલેડિયમના પ્રાથમિક દર ૨૩૦૦ રૂપિયા ૧,૨૧,૨૪૪ મુકાતા હતા.

મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ	મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ
IPO	મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ	મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ	મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ	મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ	મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ	મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ	મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ	મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ	મ્યુચ્યુઅલ ફંડો દ્વારા IPOમાં રોકાણ

અમદાવાદના બજારો	અમદાવાદના બજારો
અમદાવાદના બજારો	અમદાવાદના બજારો
અમદાવાદના બજારો	અમદાવાદના બજારો
અમદાવાદના બજારો	અમદાવાદના બજારો
અમદાવાદના બજારો	અમદાવાદના બજારો
અમદાવાદના બજારો	અમદાવાદના બજારો
અમદાવાદના બજારો	અમદાવાદના બજારો
અમદાવાદના બજારો	અમદાવાદના બજારો
અમદાવાદના બજારો	અમદાવાદના બજારો
અમદાવાદના બજારો	અમદાવાદના બજારો

ચીન પર અમેરિકાએ ટેરિફ ઘટાડતા દેશના ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની ચિંતા વધી મુંબઈ, તા. ૧૦
અમેરિકા તથા ચીન વચ્ચેની વેપાર તણા હળવી થવા સાથે દેશના ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને કટોકટી પડવાની શક્યતા ઝાંઘરી રહી છે. ચીનના માલસામાન પરના ટેરિફમાં ઘટાડો કરતા ભારતના ઇલેક્ટ્રોનિક્સ

સૂર્યથી ઊર્જા, વિશ્વાસથી પ્રગતિ.

Industry 4.0 4 GW 3M+

Aligned Facilities Manufacturing Capacity Modules Shipped

Statement Of Unaudited Consolidated Financial Results For H1 FY2026 (Rs. In Lakhs)

	H1 FY2026	H1 FY2025
TOTAL REVENUE	41,568	27,417
EBITDA	6,091	2,637
PAT	3,049	1,308

The full format of the Financial Results are available on the Stock Exchange websites (www.nseindia.com) Symbol - SOLEX and on Company's Website (www.solex.in).

Our High-Efficiency Including Tapti R, Tapti Trans Dual, Tapti Product Range: 625W of solar power for next-gen solar systems.

Tapti

1800 572 8787 info@solex.in @solex.in

Corporate & Registered Office: Solex Energy Limited, Bth Floor, Rio Empire, Opp. RTO, Pat. Surat - 395008, Gujarat

WE ARE HIRING

INTERIOR DESIGNERS & ARCHITECTS FOR SURAT

Fresher to 4 yrs experience

Those who are passionate, creative & hardworking apply to join us.

Send your resume to: shamana.d@gmail.com or 8347006501

WE SHALL CALL FOR INTERVIEW DIRECTLY

GS APPOINTMENTS

Required

- Architect
- Interior Designer
- Draftsman &
- Civil engineer

(min 5 years experience)

6359186249

જોઈએ છે

ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ)

સાલારી સોલાર 99135 36443

sabarsolar@gmail.com

જોઈએ છે

ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ)

સાલારી સોલાર 99135 36443

sabarsolar@gmail.com

GS

પ્રતિ કોલમ સે.મી. રૂ. ૬૬૦

ઓપોન્ટમેન્ટ દર મંગળ-ગુરુ અને શનિવાર પ્રસિદ્ધ થાય છે

ગુજરાત સમાચાર ભવન, ઉધના દરવાજા, રોડરોડ, સુરત-૩૯૫૦૦૨ સેલ : ૮૬૩૪૫૪૬, ૮૬૩૪૫૪૬ • ફોન : ૮૬૩ ૪૦૪૦

વિશ્વસ્તરીય લેવેરજ કંપનીમાં તાત્કાલિક ભરતી

જગ્યા : ઓપરેટર (Filler/Capper, Process, Blow Moulding, Labeller, Syrup Room, Utilities, Technician, Boiler Operator)

ફુલ જગ્યાઓ : 100

લાયકાત : ૧) ઇટી ડિગ્રી, ઇલેક્ટ્રીશીયન, ઇન્ડસ્ટ્રીયલ મેકેનિક ૨) ડીપ્લોમા - મેકેનિકલ, ઇલેક્ટ્રીશીયન, ઇન્ડસ્ટ્રીયલ મેકેનિક ૩) ડીપ્લોમા - ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ) ૪) ડીપ્લોમા - ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ) ૫) ડીપ્લોમા - ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ)

અનુભવ : ૩ થી ૫ વર્ષ (લેવેરજ ઉદ્યોગમાં - Kronen / Sidel / KHS મશીનો પર) ઉંમર : ૨૮ વર્ષથી ઓછો

વેતન : રૂ. ૩૦,૦૦૦/- થી રૂ. ૩૫,૦૦૦/- પ્રતિ મહિના + અન્ય લાભો

જોગ્યા : બારડોલી (સુરત નજીક) શિફ્ટ : રોટેશનલ

વોક - ઈન્ : 1) મુંબઈ, સુરત - ૧૪ નવેમ્બર : સોમવાર : સમય : ૯:૦૦ થી ૧:૦૦

ઇન્ટરવ્યુ : 1) અંકલેશ્વર - ૧૪ નવેમ્બર : સોમવાર : ૧ થી ૪

લાભવાન ઇલાખે : CV બાઈન્ડિંગ, ૩ મહિનાનો પગાર વધુ, પાસપોર્ટ સાઈઝ ફોટો

E-mail : varsha@hyprleap.com

WhatsApp No. : 8957547136 વા. "BARDOOLI OPERATOR" લખી CV મોકલો.

WANTED

We wish to appoint solar Marketing Executives for MARKETING OF SOLAR PROJECTS, CHARGING STATIONS SOLUTIONS, SOLAR PUMP MARKETING IN AGRICULTURE AREA.

Incumbent must be a 12th Pass.

Diploma Electrical Engineer, ITI Qualified Wireman.

SALARY PACKAGE shall be between RS. 20,000/- to RS. 35,000/- depending upon candidates technical and marketing capability.

MAIL YOUR RESUMES

pradeep_deputy@yahoo.com | deputypradeep@gmail.com

જોઈએ છે

ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ)

સાલારી સોલાર 99135 36443

sabarsolar@gmail.com

જોઈએ છે

ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ)

સાલારી સોલાર 99135 36443

sabarsolar@gmail.com

Nirmal HOSPITALS

Care par excellence

PEDIATRICIAN

RADIOLOGIST

PAEDIATRIC INTENSIVIST

NIGHT REGISTRAR

Diploma/MD (Anesthesia/Medicine)

MEDICAL OFFICERS (MBBS/BAMS/BHMS)

NURSING STAFF - OT & ICU (GNM / B.Sc.)

Submit all qualifications and registration certificates under relevant councils.

Apply now Send your CV with cover letter to coo.nha@nirmalhospitals.in

Nirmal Hospitals, Ring Road & Adajan, Surat. M: +91 78618 12611.

WANTED

We wish to appoint solar Marketing Executives for MARKETING OF SOLAR PROJECTS, CHARGING STATIONS SOLUTIONS, SOLAR PUMP MARKETING IN AGRICULTURE AREA.

Incumbent must be a 12th Pass.

Diploma Electrical Engineer, ITI Qualified Wireman.

SALARY PACKAGE shall be between RS. 20,000/- to RS. 35,000/- depending upon candidates technical and marketing capability.

MAIL YOUR RESUMES

pradeep_deputy@yahoo.com | deputypradeep@gmail.com

જોઈએ છે

ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ)

સાલારી સોલાર 99135 36443

sabarsolar@gmail.com

જોઈએ છે

ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ)

સાલારી સોલાર 99135 36443

sabarsolar@gmail.com

SARVAJANIK EDUCATION SOCIETY

M.T.B. College Campus, Athwales, Surat-395001

Ph. No. : 91 9723044455 Website: www.ses-surat.org

REQUIRES

Principal for English Medium Primary School

- Graduate/Post Graduate with M.Ed./B.Ed. and a minimum of 12 years of teaching experience in an English Medium school.
- Preference will be given to candidates who have worked as Principal/Vice Principal.

Civil Supervisor / Engineer

- Degree holders having experience in the field of construction work and knowledge of the AUTOCAD software will be given preference.

Assistant Teacher in Higher Secondary English Medium School for Physics subject (Contractual)

- M.Sc., B.Ed. and having teaching experience will be given preference.

Assistant Teacher in Secondary English Medium School for English, SS Subject (Contractual)

- B.A./M.A., B.Ed. and having teaching experience will be given preference.

Accounts Clerk

- Commerce Graduate having knowledge of Tally software and account related work.

Peon

- Minimum Qualification H.S.C.

For more details and to apply, please visit the website mentioned above within ten days from the date of this advertisement.

Date: 11-11-2025 Secretary

ABHINAV EDUCATION TRUST

Vivekanand College for BCA, B.Com, BBA, B.Ed.

Near Saroli Bridge, Jahangirpura, Surat-Old Road, Surat-5.

Ph: 7043365488, web: www.abhinaveducationtrust.org

E-mail: vivekanandcollege@gmail.com

Affiliated with Veer Narmad South Gujarat University, Surat

EMPLOYMENT NOTICE (Sixth Attempt)

Sr. No.	College Name	Name of the Post	No. of Posts	Subject & Faculty
1	Vivekanand College for BCA	Assistant Professor	3	Computer
2	Vivekanand College of Commerce	Assistant Professor	1	Commerce
3	Vivekanand College for BBA	Assistant Professor	1	Finance / Accountancy
4	Vivekanand College for B.Ed.	Assistant Professor	2	Marketing
5	Vivekanand College for B.Ed.	Assistant Professor	2	Perspectives (Psychology, Sociology, Political Science, Social Science or Sociology)
6	Vivekanand College for B.Ed.	Assistant Professor	2	Pedagogy (Accountancy-I, English-I)

Qualifications, Experience, pay scale and service conditions are as per norms of NCTE, UGC regulations 2018 and Veer Narmad South Gujarat University, Surat and Institute. Interested candidates should apply with their detailed curriculum vitae along with photographs, attested certificates, mark sheets, testimonials within 10 days from the date of publication of this employment notice in favor of Managing Trustee, Abhinav Education Trust, Vivekanand College for BCA, B.Com, BBA, B.Ed., Jahangirpura, Surat.

Note: Candidates who do not possess NET/SET/PT/DT may also apply as Teaching Assistant as per norms of V.N.S.G.U. They will be considered for interview in absence of eligible candidate for remaining vacant positions of Assistant Professor. P.S. Note: All Vacancies may vary.

Date: 11-11-2025 Managing Trustee

જોઈએ છે

ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ)

સાલારી સોલાર 99135 36443

sabarsolar@gmail.com

જોઈએ છે

ફોલોવિંગ ક્લેસ્ટર ઓફ ઇન્ટિરિયર અને ઇટી (ઇલેક્ટ્રિકલ)

સાલારી સોલાર 99135 36443

sabarsolar@gmail.com

35

अिये लोग,
अियी पसंद®

RMD
PAN MASALA
Formulation by
Akal Handshand Sharma

लोग, अियी पसंद

PREMIUM

RMD
PAN MASALA
Formulation by
Akal Handshand Sharma

अिये लोग, अियी पसंद

MRP
₹10
2g

**NEW
PACK**

**NO TOBACCO,
NO NICOTINE**

अियी पसंद®